



ASIAN PETROPRODUCTS AND EXPORTS LIMITED

CIN: L23209GJ1991PLC016666

Regd. Office: 24, Suwarnapuri Socety, Chikwadi, Near Jetalpur Road, Alkapuri, Vadodara 390 007

Website: www.asianpetro.in Email: barodagroup99@gmail.com

No. 386/fy25-26

17th November, 2025

The Corporate Relationship Department
BSE Limited
1st Floor, New Trading Ring,
Rotunda Bldg., P.J. Towers, Dalal Street,
Fort, Mumbai-400 001

SCRIP CODE: 524434

SYMBOL: ASINPET

Subject: Newspaper Advertisement of extract of Un-audited Financial Results for the Quarter and Half year ended on 30th September, 2025.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 17th November, 2025* and 16th November, 2025 respectively of Un-audited Financial Result for the Quarter and Half year ended 30th September, 2025 in:

1. English Newspaper – Business Standard and
2. Regional Language Newspaper (Gujarati) – Gujarat Samachar.

Kindly take the same on your record and oblige us.

Thanking you,

Yours Faithfully,

For ASIAN PETROPRODUCTS AND EXPORTS LIMITED


**JK Chaturvedi
Managing Director**

Encl. as above

***The Business Standard does not publish its Sunday Edition.**

Brijlaxmi Leasing and Finance Limited					
Regd. Office: 24, Suwernapuri Socetty, Chikwadi, Near Jetalpur Road, Alkapuri, Vadodara 390 007					
Website: www.brijlaxmi.com, Email: barodagroup99@gmail.com.					
CIN: L65993GJ1990PLC014183					
Extract of Unaudited Financial Results for the Second Quarter and Half Year ended on 30 th September, 2025					
(Rs. in Lakhs)					
Sr. No.	Particulars	Quarter ended		Half Year ended	
		30.09.2025	30.09.2024	30.09.2025	31.03.2025
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total Income from Operations	64.93	55.21	121.27	130.73
2.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional Items & or Extraordinary Items)	46.46	(72.45)	59.76	213.98
3.	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or Extraordinary Items)	46.46	(72.45)	59.76	213.98
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	38.06	(72.45)	46.09	158.29
5.	Total comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	24.67	(72.45)	24.09	158.29
6.	Paid up Equity Share Capital	646.35	646.35	646.35	646.35
7.	Earning per share	0.59	(1.12)	0.71	2.45
Note:					
1. The above standalone financial results for the quarter ended 30.09.2025 have been reviewed by the Audit Committee and there after approved and taken on record by the Board of Directors of the Company at their meeting held on 14 th November, 2025.					
2. The Financial Results for the quarter ended 30 th September, 2025 has been review by the Statutory Auditors of the Company.					
3. The Company being engaged in Investment and financing activities and accordingly there is no separate reportable segment as per IND AS 108 specified under section 133 of the Companies Act, 2013.					
4. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures. Comparable, wherever necessary.					
By the Order of the Board Sd/- Siddharth Chaturvedi Managing Director and CFO					
Date : 14.11.2025 Place : Vadodara					

Asian Petroproducts and Exports Limited					
New Regd. Office: 24, Suwernapuri Socetty, Chikwadi, Near Jetalpur Road, Alkapuri, Vadodara 390 007					
Website: www.asianpetro.in, Email: barodagroup99@gmail.com.					
CIN: L23209GJ1991PLC016666					
Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30 th September, 2025					
(Rs. in Lakhs)					
Sr. No.	Particulars	Quarter ended		Half Year ended	
		30.09.2025	30.09.2024	30.09.2025	31.03.2025
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total Income from Operations	4370.54	0.00	4841.64	4167.05
2.	Net Profit/(Loss) for the period before tax,	(4.75)	(44.39)	8.97	(117.65)
3.	Net Profit/(Loss) for the period after tax	(4.75)	(44.39)	8.97	(117.65)
4.	Total comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(4.75)	(44.39)	8.97	(117.65)
5.	Paid up Equity Share Capital	2455.79	866.75	2455.79	2455.79
6.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	-
7.	Earning per share				
1. Basic (in Rs.)	(0.02)	(0.51)	0.04	(0.48)	
2. Diluted (in Rs.)	(0.02)	(0.51)	0.04	(0.48)	
Note:					
1. The above Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Companies Act, 2013 read with relevant Rules.					
2. The above results have been reviewed by Audit Committee of Directors and approved by the Board of Directors at their Meeting held on 14 th November, 2025.					
3. The Company operates under single segment.					
4. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.					
By the Order of the Board Sd/- Jaykishor Chaturvedi Managing Director					
Date : 14.11.2025 Place : Vadodara					



STATE BANK OF INDIA

DEMAND NOTICE

SBI, Nagalpur Branch, Mehsana

A notice is hereby given that the following Borrowers/Guarantors viz. **Shri Sudhirkumar Prasinghakumar Pathak**, have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non- Performing Assets (NPAs). The notices were issued to them under Section 13(2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have been returned un-served and as such they are hereby informed by way of this public notice.


Loan Account No:-35407569136

S.N.	Name of the Borrower	Details of Immovable Properties	Date of Notice	Date of NPA	Amount outstanding as on 24-10-2025
1	Sudhirkumar P.Pathak	Property owned by: Sudhirkumar P.Pathak New Survey No 485 Shree Balaji Status, Third Floor Flat no 2/H/304 Nagalpur, Ta. & Dist. Mehsana (GJ) 384002 All those pieces and parcels of the immovable property Situated with construction there on	24.10.2025	20.10.2025	HOME LOAN Rs. 2555220

The steps are being taken for substituted service of notice. The above Borrower(s) and/or their Guarantor(s) (whenever applicable) are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002.

Date : 24/10/2025
Place: Mehsana

Authorized Officer
State Bank of India



HDFC BANK

Head Office: HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai – 400 013
Regional Office: : HDFC Bank Ltd., Department for Special Operations,4th Floor, “Aakansha Building” Opp–J K Hero, 10–Vijay Plot Corner, Gondal Road, Rajkot–360002.

E-AUCTION SALE NOTICE

PUBLIC NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES BY WAY OF PRIVATE TREATY

E–Auction Sale Notice for Sale of immovable property mortgaged to Bank under Securitization and Reconstruction of Financial assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rule, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s)/Mortgagor(s)/Guarantor(s) that, the Authorized Officer(s) of **HDFC BANK LTD.** had taken physical possession of the following property/ies mentioned, pursuant to demand raised vide notice(s) issued under Sec 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 in the following loan accounts with right to sell the same on **“AS IS WHERE IS, AS IS WHAT IS, WHATEVER IS THERE IS AND WITHOUT RECOURSE BASIS”** for realization of Bank’s dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules proposes to realize the Bank’s dues by sale of the said property/ies. The sale of the below–mentioned Properties shall be conducted by way of E–Auction through Web Portal: <https://www.bankauctions.com>.

Sr. No.	Name of the Branch & Account	Name of the Mortgagor & Guarantors of the property	Details of collateral property	Amount as per Demand Notice Demand Notice Date	Inspection Date and Time	Reserve Price EMD Bid Increase Amount	Date / Time of e–Auction	Last Date of Receipt of Bids alongwith EMD	Name of Authorised Officer / Phone No. / Email id
Lot No. 1	HDFC Bank Ltd. Branch – Bhachau – Vinod Khimji Morabia A/C No. 22958430000040	Mortgagor – Mrs. Sarojben V Morabiya Guarantors – Mrs. Sarojben V Morabiya and Mr. Vinod Khimji Morabia	Residential Property Situated at Plot No. 65/66, Paiki 3, Revenue Survey No. 1262 Paiki, Vardhman Nagar, Bhachau – Kutch, Owned by Mrs. Sarojben Morabia and the four boundaries of the property are as under. Area: 83–64 Sq. Mts. North – Road, South – Plot No. 67, East – House No. 2 of Plot No. 65–66, West – House No. of Plot No. 65–66	₹ 44,25,240.65/– Demand Notice dated 05.03.2018	6 th December 2025 from 11:00 AM To 01:00 PM	Reserve Price– ₹ 25,00,000/– EMD– ₹ 2,50,000/– Bid Increase amount– ₹ 1,00,000/–	18 th December 2025 from 2:00 PM To 3:00 PM	17 th December 2025 upto 4:00 PM	Pathik Dave/ 09033319756/ pathik.dave@hdfcbank.com

TERMS & CONDITIONS:

- The e–Auction is being held on **“AS IS WHERE IS, AS IS WHAT IS, WHATEVER IS THERE IS AND WITHOUT RECOURSE BASIS”**.
- The interested bidders shall submit their EMD details and documents through Web Portal: <https://www.bankauctions.com> (the user ID & Password can be obtained free of cost by registering name with <https://www.bankauctions.com>) through Login ID & Password. The EMD shall be payable EITHER through NEFT / RTGS in the following Account: **57500000904261**, Name of the Account: **DFSO Transitory account**, Name of the Beneficiary: **HDFC BANK LTD., IFSC Code: HDFC0000240**. Please note that the Cheques / Demand Drafts shall not be accepted as EMD amount.
- To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance i.e. statutory dues like property taxes, society dues etc as per Bank’s record on the property other than the one mentioned in detailed terms and conditions. The Bank however shall not be responsible for any present/past/future outstanding non–statutory dues/statutory dues/encumbrances/tax arrears/litigations, if any. The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property/ies & to inspect & satisfy themselves. **Property can be inspected strictly on the above–mentioned date and time.**
- The intended bidders who have deposited the EMD and require assistance in creating Login ID & Password, uploading data, submitting bid, training on e–bidding process etc., may contact our service provider **M/s. C1 India Pvt. Ltd., 3rd Floor, Plot No 68, Sector–44, Gurgaon, Haryana–122003. Support Mobile Number: –7291981124/1125/1126, Mr. Bhavik Pandya–08866682937, E–mail ID: support@bankauctions.com/gujarat@c1india.com**. For any property or Plant & machinery related query may contact the **Authorized officer as mentioned above** in office hours during the working days. (10:00 AM to 5:00 PM).
- If the Sale Price is more than Rs.50,00,000/– (Rupees Fifty Lakh Only) then the auction purchaser/successful bidder has to deduct 1% of the Sale Price as TDS in the name of the owner of the property & remit it to Income Tax Department as per section 194 IA of Income Tax Act and only 99% of the Sale Price has to be remitted to the Bank. The Sale Certificate will be issued only on receipt of Form 26QB & Challan for having remitted the TDS.
- The highest bid shall be subject to approval of HDFC Bank Limited. Authorized Officer reserves the right to accept/ reject all or any of the offers/ bids so received, or cancel the auction/sale without assigning any reasons whatsoever. His decision shall be final & binding.
- (FOR DETAILED TERM AND CONDITIONS PLEASE REFER TO OUR WEBSITE www.hdfcbank.com and www.bankauctions.com)**

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002

This may also be treated as notice u/r 8(6) read with Rule 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to borrowers/ and Guarantors of the above said loan about the holding of E–Auction Sale on the above mentioned date. The borrower/ guarantors/mortgagors are hereby notified to pay the sum as mentioned above along with upto date interest and ancillary expenses before 30 days of this notice/the date of Auction, failing which the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with interest and cost.

Date: 17.11.2025
Place: Rajkot

Authorised Officer
HDFC BANK LIMITED



ISHAN DYES AND CHEMICALS LIMITED

CIN: L24110GJ1993PLC020737

Reg. Off: Plot No. 18, GIDC Estate, Phase I, Vatva, Ahmedabad - 382445, Gujarat, INDIA

E-mail: ishandyes@yahoo.com • Website: www.ishandyes.com

EXTRACTS OFA UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER 2025.

The Full format of the Unaudited Standalone Financial Results of the Company for the Quarter and Half Year ended on 30th September 2025 are available on the Stock Exchange(s) Website (www.bseindia.com) and (www.nseindia.com) and on the Company's website (www.ishandyes.com).

The same can be accessed by scanning the QR Code provided below.



On behalf of Board of Directors
For, Ishan Dyes & Chemicals Limited
Shrinal P. Patel
Whole Time Director
DIN:02992519

Place : Ahmedabad
Date : 15.11.2025



RAVI KUMAR DISTILLERIES LIMITED

CIN: L51909PY1993PLC008493

Regd. Office: C- 9 & 10, Industrial Estate, 2nd Main Road, Thattanchavady, Puducherry - 605 009.

Ph : 0413-2244007, 2248888, 2248887

E-mail: cs@ravikumardistilleries.com

Website : www.ravikumardistilleries.com

NOTICE OF POSTAL BALLOT

NOTICE is hereby given pursuant to and in compliance with the provisions of Section 110 of the Companies Act, 2013 and Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, read with the General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 22/2020 dated 15th June, 2020, General Circular No. 33/2020 dated 28th September 2020, General Circular No. 39/2020 dated 31st December, 2020, General Circular No. 10/2021 dated 23rd June, 2021, General Circular No. 3/2022 dated 05th May, 2022, General Circular No. 11/2022 dated 28th December, 2022, General Circular No. 09/2023 dated 25th September, 2023, General Circular No. 09/2024 dated 19th September, 2024 and General Circular No. 03/2025 dated 22nd September, 2025 issued by the Ministry of Corporate Affairs (“MCA Circular”) and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, and pursuant to other applicable laws and regulations (including any statutory modification or re-enactment thereof for the time being in force, and as amended from time to time), the approval of shareholders of Ravi Kumar Distilleries Limited (the “Company”) is being sought for Appointment of Mrs. Shannmugam Vidhyasankari (DIN: 06869213) as an Non-Executive Non-Independent Woman Director of the Company effective from 13th November 2025 liable to retire by rotation.

Pursuant to the MCA Circulars, the Company has sent the electronic copies of the Postal Ballot Notice along with Explanatory Statement on 15th November, 2025 to all the Members of the Company, who have registered their e-mail address with the Company (in respect of the shares held in physical form) or with Depository Participant (in respect of the shares held in electronic form) as on Friday, 14th November, 2025 i.e. the cut-off date. The Postal Ballot Notice will also be available on the website of the Company at <https://www.ravikumardistilleries.com> the website of Kfin Technologies Limited at <https://evoting.kfintech.com> and website of BSE Limited at www.bseindia.com and NSE Limited at www.nseindia.com.

In accordance with the provisions of the MCA Circulars, Shareholders can vote only through the remote e-voting process, physical copies of the Postal Ballot Notice and pre-paid business reply envelopes are not being sent to shareholders through this Postal Ballot. Shareholders whose names appear on the Register of Members/List of Beneficial Owners as on Friday, 14th November, 2025 will be considered for the purpose of e-voting and Voting rights of a Member or Beneficial Owner (in case of electronic shareholding) shall be in proportion to his/her/its shareholding in the paid-up equity share capital of the Company as on the Cut-Off Date. Shareholders are requested to note that e-voting will commence at 9:00 a.m. (IST) on Tuesday, 18th November, 2025 and ends at 5:00 p.m. (IST) on Wednesday, 17th December, 2025. Members desiring to exercise their vote should cast their vote during this period, to be eligible for being considered.

Members who have not registered their e-mail address are requested to register the same in respect of shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Company’s Registrar and Share Transfer Agent, Kfin Technologies Limited, KFin, Selenium, Tower B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Rangareddi-500032, Telangana India or e-mail at eiinward.ris@kfintech.com along with the copy of the signed request letter mentioning the name & address of the Member, self-attested copy of the PAN card, and self-attested copy of any document (e.g.: Driving License, Election identity Card, Passport in support of the address of the member). The instructions on the process of e-voting, including the manner in which Members who are holding shares in physical form or who have not registered their e-mail addresses can cast their vote through- voting, are provided in the Postal Ballot Notice.

The Board of Directors of the Company at their meeting held on 13th November, 2025 has appointed CS. Mr. Uttam Shetty, (Membership No. FCS 8691/COP 16861) Partner of Uttam Shetty & Co., Practicing Company Secretaries, as the scrutinizer for conducting the postal ballot through the e-voting process in a fair and transparent manner.

The Scrutinizer will submit his report to the Managing Director of the Company or any person authorized by the Board. The results shall be declared on or before Friday, 19th December, 2025 and communicated to BSE Limited, NSE Limited, Registrar and Share Transfer Agent and will also be displayed on the Company’s website.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for shareholders and e-voting User Manual for shareholders available at the download section of <https://evoting.kfintech.com>. In case of any queries / concern / grievances, you may M/s. C Shobha Anand, Vice President, KFin, Selenium, Tower B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Rangareddi-500032, Telangana India, or email : eiinward.ris@kfintech.com; Toll Free No. 1800 309 4001.

For Ravi Kumar Distilleries Limited
Sd/-
R.V Ravi Kumar
Managing Director
DIN: 00336646

Place : Puducherry
Date : 15.11.2025



बैंक ऑफ़ इंडिया Bank of India

ZONAL OFFICE : RAJKOT ZONE, Para Bazar, M G Road, Rajkot. Ph. : 0281 2232388
Mo. : 97718 37201 / 90990 58339
Rajkot.ARD@bankofindia.co.in

FOR SALE OF MOVABLE & IMMOVABLE ASSETS UNDER THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISION TO RULE 6(2) AND 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES,2002.

E-AUCTION DT. : 19.12.2025 SALE NOTICE

Under “AS IS WHERE IS”, “AS IS WHAT IS”, and “WHATEVER THERE IS” basis

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described (Movable & Immovable Property/ies) mortgaged/hypothecated/pledged/charged to the bank of India. The constructive / physical possession of which has been taken by the Authorized Officer of Bank of India. (Secured Creditor), will be sold on “As is where is”, “As is what is”, and “Whatever there is” basis on 19.12.2025

IMPORTANT DATES : Date & Time of Inspection of the Property : 16.12.2025 & 17.12.2025 (From 11.00 AM to 2.00 PM)
Last Date for Submission of EMD : 19.12.2025 by 4.00 PM
Last Date for Submission of Bids : 19.12.2025 by 5.00 PM
Date & Time of E-Auction : 19.12.2025 from 11.00 AM to 5.00 PM (With auto extensions of 5 minutes duration)

Sr/ Lot No.	Name & address of Borrower/s / Guarantor/ s / Proprietor	Description of the Movable & Immovable Property	Type of possession	Date of notice under section 13(2) Demand Notice & amount mentioned in the notice	Minimum Reserve price (Amount in Lakhs)	EMD (Amount in Lakhs)	Name, Address Mobile No. of Beneficiary Branch, A/C No. & IFSC Code
01	Borrower : M/s Laxmi Telecom (Proprietorship) Proprietor: 1. Mr. Maheshkumar Laxmidas Vasant Residing at : Gajanand – Near Atkot Gram Panchayat office, Near Masjid, Main Bazar Road, At Atkot, Tal-Jasdan, Dist- Rajkot - 360 040.	Double Storied Residential House at Atkot, Tal-Jasdan, Dist-Rajkot-360040 over Plot no. Mamlatdar Saheb Jasdan Na Hukum No.Jaman/Vashi/215/14 Regi. No. 6 Dt.29.01.2014 Plot Area : 149.76 Sq. Mts Buildup Area: 203.34 Sq. Mts Registered Owner : Proprietor Mr. Maheshkumar Laxmidas Vasant	Symbolic	Notice Dt. : 01.05.2025 Notice Amount: Rs.16.16 lakhs and interest & other charges thereafter. Possession Dt. : 01.09.2025	40.43	4.05	Bank of India, Atkot Branch, Rajkot Mob no: 90990 58311 Pool A/c no (15 digit): 311190200000033 IFSC (letter in 4, 5 & 6 are zero: BKID0003111 A/c Name : INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE
02	Borrower : M/s Atkot auto Service- II (Proprietorship) Proprietor: 1. Mr. Maheshkumar Laxmidas Vasant Guarantor : 1. Mrs. Shobhnaben Mahesh Vasant All Residing at : Gajanand – Near Atkot Gram Panchayat office, Near Masjid, Main Bazar Road, at Atkot, Tal - Jasdan, Dist- Rajkot - 360 040.	Residential House with (GF) Shop Premises at Shree Labh/ Shree Shubh, Near Atkot Gram Panchyat, Main Bazar Road, Plot no. Gamtal Plot, Gram namuna no.2. Sr no. 1095, TPS/ Village –Atkot, Mauja –Atkot, tal-Jasdan, Dist-Rajkot 360040 Plot Area : 138.61 Sq. Mts Registered Owner: Proprietor Mr. Maheshkumar Laxmidas Vasant	Symbolic	Notice Dt. : 01.05.2025 Notice Amount: Rs. 30.66 lakhs and interest & other charges thereafter Possession Dt. : 01.09.2025	24.85	2.49	Bank of India, Atkot Branch, Rajkot Mob no: 90990 58311 Pool A/c no (15 digit): 311190200000033 IFSC (letter in 4, 5 & 6 are zero: BKID0003111 A/c Name : INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE
03	Borrower : M/s B.K. Enterprise (Proprietorship) Proprietor: 1. Bhartiben Vimalbhai Katariya Residing at : Laxmi Krupa, Gimar Society Street No. 01, Near Ankur Vidyalay, Rajkot- 360 004.	Industrial Plot & Building constructed under RS No.139/1 Paiki 1, Plot No.115 Paiki, Golden Industrial Estate - C, Behind Om Sai Forge, Near Perfect Stamping Pvt. Ltd, Off Shapur – Virva Road, At - Pipaliya Pal, Tal-Lodhika, Dist-Rajkot-360 311. Plot Area : 188.58 Sq. Mts Registered Owner : Proprietor Mrs. Bhartiben Vimalbhai Katariya	Symbolic	Notice Dt. : 14.07.2025 Notice Amount : Rs. 40.65 lakhs and interest & other charges thereafter Possession Dt. : 01.10.2025	27.67	2.77	Bank of India, Bedipara Branch, Rajkot Mob no: 90990 58311 Pool A/c no (15 digit): 310890200000033 IFSC (letter in 4, 5 & 6 are zero: BKID0003108 A/c Name: INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE
04	Borrower : 1. Vijaybhai Kishorbhai Vadodara 2. Bharti Vijay Vadodara Residing at : Block No. 12, Qtr No. 347, Dharamnagar, Avas Yojana RMC QTR, Behind Starling Hospital, Rajkot, Gujrat- 360 007	Flat No. A - 305, 3rd Floor, Arham Residency, At-Behind - Nageshwar Jain Temple, Rajkot - Jamnagar Highway, At - Ganteshwar, Dist- Rajkot- 360 006. Buildup Area: 49.84 Sq. Mts, (536 Sq. Feet) Registered Owner : Borrower Mr. Vijaybhai Kishorbhai Vadodara	Symbolic	Notice Dt. : 11.06.2025 Notice Amount : Rs. 20.70 Lakhs and Interest & Other Charges thereafter. Possession Dt. : 10.10.2025	18.00	1.80	Bank of India, LakhajiRoad Branch, Rajkot Mob no: 90990 58301 Pool A/c no (15 digit): 310190200000033 IFSC (letter in 4, 5 & 6 are zero: BKID0003101 A/c Name: INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE
05	Borrower : M/s Balaji Decor (Proprietorship) Proprietor: Vipulkumar Gokalbhai Valand Residing at : Flat No. 301, 3rd Floor, Shyam Palace Apartment, Bony Park,, Ravapar, Morvi- 363 641.	Flat No. 301, 3rd Floor, Shyam Palace Apartment, Bony Park,, Ravapar, Morvi- 363 641. Buildup Area: 58.13 Sq. Mts. (625.75 Sq. Feet) Registered Owner : Borrower Mr. Vipulkumar Gokalbhai Valand	Symbolic	Notice Dt. : 08.08.2025 Notice Amount : Rs. 37.41 Lakhs and Interest & Other Charges thereafter. Possession Dt. : 01.11.2025	19.68	1.10	Bank of India, Morvi Branch, Morvi Mob no: 90990 58316 Pool A/c no (15 digit): 311690200000033 IFSC (letter in 4, 5 & 6 are zero: BKID0003116 A/c Name: INTERMEDIARY INWARD OUTWARD REMITTANCE

Important Points :

- ✓ Bid will be accepted only if the bidder bid over and above the Reserve Price.
- ✓ Property costing above Rs.50 lakhs attracts 1% TDS. It shall be the responsibility of successful bidder to remit TDS @ 1% as applicable u/s 194-IA of Income Tax Act.
- ✓ Successful bidder should be ready with 25% (Less EMD already paid) of their bid price as same is to be deposited with Bank on close of auction or

યુએસ ટેરિફ્નો ઓક્ટોબરમાં ભારતને બેવડો ફટકો લાગ્યો

રત્નો અને ઝવેરાતની નિકાસમાં ૩૦%નો ઘટાડો

ચલણમાં વધઘટ અને મજબૂત ડોલરના કારણે ભાવ સ્પર્ધાત્મકતા અને વેપાર વોલ્યુમ પર વધુ અસર પડી

નવી દિલ્હી, તા. ૧૫
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ધીમી આર્થિક વૃદ્ધિ, ઊંચા વ્યાજ દરો અને સાવચેત શ્રાહક ખર્ચને કારણે મુખ્ય બજારોમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ અને આયાતમાં ઘટાડો થયો હતો. ભૂરાજકીય અનિશ્ચિતતાઓ અને સંખ્યાય ચેઇન વિશેષોએ પણ વેપારને અસર કરી હતી.



જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના જણાવ્યા અનુસાર, નબળી વૈશ્વિક માંગ અને ઊંચા ટેરિફ વચ્ચે ઓક્ટોબરમાં ભારતના રત્નો અને ઝવેરાતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ય્લઈઝ ના ડેટા અનુસાર, નબળી વૈશ્વિક માંગ, ઊંચા

વ્યાજ દરો, સંખ્યાય ચેઇન વિશેષો અને તીવ્ર યુએસ ટેરિફની અસરને કારણે મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ અને આયાતમાં ઘટાડો થયો છે. ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર ૨૦૨૫ માં કુલ નિકાસ ૩૦.૫૭ ટકા ઘટીને US\$૨,૧૬૮.૦૫

મિલિયન (રૂ. ૧૮.૧૭૨.૮૮ કરોડ) થઈ છે, જે એક વર્ષ પહેલા US\$૩,૧૨૨.૫૨ મિલિયન (રૂ. ૨૬.૨૩૭.૧૦ કરોડ) હતી. આયાત પણ ૧૮.૨૮ ટકા ઘટીને US\$૧૨૭૬.૮ મિલિયન (રૂ. ૧૧,૨૮૮.૬ કરોડ) થઈ છે જે

ગયા વર્ષના સમાન મહિનામાં US\$૧૫૮૦.૧૩ મિલિયન (રૂ. ૧૩,૨૭૬.૨૬ કરોડ) હતી. કામા જ્વેલરીના મેનેજિંગ ડિરેક્ટર કોલિન શાહે જણાવ્યું હતું કે અગાઉ લાદવામાં આવેલા વેપાર ટેરિફની અસર હવે અનુભવાઈ રહી છે. આનાથી ખર્ચમાં વધારો થયો છે અને ખરીદીમાં ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીઓ તહેવારોની મોસમ પછી બજારની પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે તેમના સ્ટોક સ્તરને પણ સમાયોજિત કરી રહી છે. સ્થાનિક સ્તરે, સોના અને હીરાના ભાવમાં વધઘટ, નિકાસકારો માટે મર્યાદિત ચિરાણ અને પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા ક્ષેત્રમાં ગોઠવણોને

કારણે આયાત અને નિકાસમાં ઘટાડો થયો. ચલણમાં વધઘટ અને મજબૂત ડોલરના કારણે ભાવ સ્પર્ધાત્મકતા અને વેપાર વોલ્યુમ પર વધુ અસર પડી, GJEPC એ ઉમેર્યું. ઓક્ટોબરમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ૨૬.૮૭ ટકા ઘટીને \$૧,૦૨૫.૫૮૯ મિલિયન (રૂ. ૮,૦૭૧.૪૧ કરોડ) થઈ. આયાત ૩૫.૭૬ ટકા ઘટીને \$132.95 મિલિયન (રૂ. ૧,૧૭૬.૭ કરોડ) થઈ. GJEPC એ નવા યુએસ ટેરિફની બેવડી અસર પર પ્રકાશ પાડ્યો, જેમાં પારસ્પરિક પગલાં અને લેબ-ગ્રોન હીરા (LGDs) થી વધેલી સ્પર્ધાનો સમાવેશ થાય છે, જે નોંધપાત્ર રીતે નીચા ભાવ ધરાવે છે, કુદરતી હીરા માટે માજિન ઘટારો છે. કાઉન્સિલે જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના દેડીયાપાડાના દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

રાજપીપલા,તા. ૧૫

આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતાં. જન્મજયંતિની મુખ્ય ઉજવણી પૂર્વે વડાપ્રધાને પૂજનીય દેવસ્થાન દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાની પૂજા-અર્ચના તેમજ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. દર્શન દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશની એકતા, સર્વાંગી વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. યાહા મોગી માતાજીના દર્શન માટે પધારેલા વડાપ્રધાનશ્રીને ટૂંકા સમયમાં ધીરસિંહ વસાવાએ આદિવાસી પરંપરાગત પાઘડી પહેરાવી હતી.ત્યારબાદ ટ્રસ્ટના



મંત્રી ક્રાંતિભાઈ કોઠારીએ વડાપ્રધાને યાંત્રીનું કડુ પહેરાવ્યું. ઉપપ્રમુખ નાનસિંહ વસાવાએ આદિવાસી પરંપરાગત કોટી પહેરાવી, જ્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજીની યાંત્રી પ્રતિકૃતિ સ્મૃતિરૂપે ભેટ આપવામાં આવી હતી.શાલ ઓઢાડી ટ્રસ્ટી મંડળે પણ વડાપ્રધાને આવકાર આપ્યો હતો. આદિવાસી પરંપરાગત વિધિ મુજબ વડાપ્રધાને હિજરી પૂજન કરી દેવમોગરા માતાજીને

ધરણાં, યાંત્રીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો હતો. દેવમોગરા ધામના પૂજારીએ ૨૦૦૩ માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે આપેલા આશીર્વાદને યાદ કરતાં માતાના ચરણોમાં પ્રાર્થના કરી કે વડાપ્રધાને નિરોગી સ્વાસ્થ્ય, અખૂટ શક્તિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, જેથી તેઓ દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં સતત સેવા આપી શકે.

બિઝનેસ આજકાલ

મેક્સિમસ ઇન્ટ. નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨૭૯ લાખ થયો

મુંબઈ : મેક્સિમસ ઈન્ટરનેશનલ લિમિટેડ સ્પેશિયાલિટી લુબ્રિકન્ટ્સ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના અગ્રણી મેન્યુફેક્ચરર અને નિકાસકારે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમયગાળાના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીએ આવક, નફાકારકતા અને મુખ્ય નાણાકીય માપદંડોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. ત્રિમાસિકમાં આવક અગાઉના ત્રિમાસિકના ૩.૯૫૨ લાખથી ૧૬% વધીને ૪,૫૮૪ લાખ થઈ, જે હાથર વોલ્યુમ અને શ્રેષ્ઠ પ્રાસિઓના કારણે શક્ય બન્યું. કાર્યકારી કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધ ખર્ચ નિયંત્રણના પગલે EBITDA ૨૪% વધીને ૪૮૨ લાખ થયો.

છૂટક કુગાવો નરમ રહેવાની અપેક્ષા જાણો RBI શા માટે મૂંઝવણમાં

નવીદિલ્હી. આ વર્ષે ઓક્ટોબરમાં ભારતનો CPI કુગાવો વર્ષ-દર-વર્ષના ધોરણે ૦.૨૫ ટકાના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. આનું કારણ બાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો હતો. આ સમયગાળા દરમિયાન શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં ઘટાડો થયો. કળી અને તેલ પણ સસ્તા થયા. એક અહેવાલમાં, SBI રિસર્ચે આ પરિસ્થિતિને RBI માટે પડકારજનક ગણાવી. સોનાના ભાવને બાદ કરતાં, છૂટક કુગાવો આગામી બે મહિના સુધી નકારાત્મક રહેવાની ધારણા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધન અહેવાલ મુજબ, કુગાવામાં આ ઘટાડો ભારત માટે અસામાન્ય છે. SBI રિસર્ચ અનુસાર, આ વર્ષે ઓક્ટોબરમાં ભારતનો CPI કુગાવો વાર્ષિક ધોરણે ૦.૨૫ ટકાના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. આનું કારણ બાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો હતો.

આ અઠવાડિયે સોનું ૧.૨૫ લાખને પાર : ચાંદી ૧૧,૦૯૨ મોંઘી થઈ

નવી દિલ્હી. ત્રણ અઠવાડિયાના સતત ઘટાડા પછી ચોથા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ૮ નવેમ્બરના રોજ સોનું ૧,૨૦,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતું, જે ૪,૬૮૪ વધીને ૧,૨૪,૭૮૪ પર પહોંચી ગયું. ૧૭ ઓક્ટોબરના રોજ, સોનું ૧,૩૦,૮૭૪ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યું, જે તેની સૌથી વધુ કિંમત હતી. આ અઠવાડિયે ચાંદીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે (૭ નવેમ્બર) ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ૧,૪૮૮,૨૭૫ રૂપિયા હતો, જે આ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ૧૪ નવેમ્બર સુધીમાં ૧,૧૦,૮૯૨ રૂપિયા વધીને ૧,૫૮,૩૬૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો.

ચંદ્રબાબુ નાયડુનું આંધ્રપ્રદેશમાં વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ

વિશાખાપટ્ટનમ,તા.૧૫
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી કે રાજ્યએ વિશ્વભરના રોકાણકારોને આવકારવા માટે ૫૦,૦૦૦ એકરની જમીન બેંક તૈયાર કરી છે. વિશાખાપટ્ટનમમાં ઝેં ભાગીદારી પરિપદના પ્રથમ પૂર્ણ સત્રમાં બોલતા, તેમણે કહ્યું કે સરકાર રાજ્યમાં કામગીરી શરૂ કરવા ઈચ્છુક ઉદ્યોગોને તાલીમ સહાય સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. તેમણે ઉદ્યોગપતિઓને આંધ્રપ્રદેશમાં ઉપલબ્ધ તકોનું અન્વેષણ કરવા અને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે જો જરૂર પડશે તો, સરકાર પ્લગ-એન્ડ-ગ્વે મોડેલને પણ પ્રોત્સાહન આપશે જેથી ઉદ્યોગો ઝડપથી કામગીરી શરૂ કરી શકે. તેમણે ઉમેર્યું કે જ્ઞાન આધારિત અર્થતંત્ર સ્થાપિત કરવામાં ભૌગોલિક અંતર હવે પડકાર નથી. મજબૂત નેતૃત્વ અને દ્રષ્ટિકોણથી, વિશ્વના સૌથી દૂરના ખૂણામાં પણ કંપની સ્થાપિત કરી શકાય છે.

આવક વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધી રૂપિયા ૩૪૦૦૦ કરોડ રહી

GSTમાંથી મુક્તિ: જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૧૨ ટકા વધારો

મુંબઈ, તા. ૧૫
વ્યક્તિગત તથા જૂથ વીમા વેપારમાં મજબૂત વૃદ્ધિને પરિણામે ઓક્ટોબરમાં જીવન વીમા ઉદ્યોગના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધી રૂપિયા ૩૪૦૦૦ કરોડ રહી હોવાનું લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષના ઓક્ટોબરમાં ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૩૦૩૪૭ કરોડ રહી હતી. એવઆઈસીની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૧૨.૫૦ ટકા વધી રૂપિયા ૧૮૨૭૪ કરોડ જ્યારે ખાનગી વીમા કંપનીઓ કંપનીઓની આવક વાર્ષિક ધોરણે ૧૧.૫૦ ટકા વધી રૂપિયા ૧૪૭૩૨ કરોડ રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવ્યું છે. પોલીસિના વેચાણની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૬૨.૭૦ ટકા

વધી ૧૮.૫૦ લાખ રહી હતી. એવઆઈસીની પોલીસિના વેચાણમાં ૧૨૦ ટકા વધારો થઈને ૧૨.૬૦ લાખ જ્યારે ખાનગી વીમા કંપનીઓ માટે આ આંક ૧૦ ટકા વધી સાત લાખ રહ્યો છે. વર્તમાન વર્ષના એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૨.૮૦ ટકા વધી રૂપિયા ૨.૪૦ લિવિયન રહી હતી.

ધી સરદાર પટેલ કો.ઓ.કેડીટ & કન્ઝ્યુમર્સ સોસાયટી-વિસનગર	
પ્રવર્તમાન કાર્યક્ષેત્રમાં સુધારે કરી મહેસાણા જીલ્લામાં હોઈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, રાજપીપળા, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર જીલ્લામાં કાર્યરત શરાફી સંસ્થાઓમાં સદર સુધારા બાબતનો વાંધો કે વિરોધ હોય તો જીલ્લા રજીસ્ટર શ્રી સહકારી મંડળીઓ, મહેસાણા બીજોમાળ, બહુમાળી ભવન ખાતે દિન-૭ માં લેખીતમાં જણાવવા વિનંતી.	
લી.ધી સરદાર પટેલ કો.ઓ.કેડીટ & કન્ઝ્યુમર્સ સોસાયટી લી., વિસનગર	

Asian Petroproducts and Exports Limited									
New Regd. Office: 24, Suwarnapuri Society, Chikwadi, Near Jetapur Road, Alkapuri, Vadodra 390 007 Website: www.asianpetro.in, Email: barodagroup99@gmail.com. CIN: L23209GJ1991PLC016666									
Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2025									
(Rs. in Lakhs)									
Sr. No.	Particulars	Quarter ended		Half Year ended		Year ended		Year ended	
		30.09.2025	30.09.2024	30.09.2025	30.09.2024	31.03.2025	31.03.2024	31.03.2025	31.03.2024
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)		
1.	Total Income from Operations	4370.54	0.00	4841.64	4167.05				
2.	Net Profit/(Loss) for the period before tax,	(4.75)	(44.39)	8.97	(117.65)				
3.	Net Profit/(Loss) for the period after tax	(4.75)	(44.39)	8.97	(117.65)				
4.	Total comprehensive income for the period (comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax))	(4.75)	(44.39)	8.97	(117.65)				
5.	Paid up Equity Share Capital	2455.79	866.75	2455.79	2455.79				
6.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	-				
7.	Earning per share								
1.	Basic (in Rs.)	(0.02)	(0.51)	0.04	(0.48)				
2.	Diluted (in Rs.)	(0.02)	(0.51)	0.04	(0.48)				
Note:									
1. The above Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Companies Act, 2013 read with relevant Rules.									
2. The above results have been reviewed by Audit Committee of Directors and approved by the Board of Directors at their Meeting held on 14 th November, 2025.									
3. The Company operates under single segment.									
4. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.									
By the Order of the Board									
Sd/- Jaykishor Chaturvedi Managing Director									
Date : 14.11.2025 Place : Vadodra									

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

1911 से आपके लिए "केन्ट्रल"

"Central" TO YOU SINCE 1911

કેન્દ્રીય કાર્યાલય, પહેલો માળ, સીટી ટેલીફોન એક્સચેન્જ, બીએસએનએલ ભવન, કુબેર ભવન ની પાસે, જેલ રોડ, વડોદરા - ૩૬૦૦૦૧.

પારિસર બેંકો રાખવા માટે લિડર્સ/ઓફિસ આમંત્રણ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, કેન્દ્રીય કાર્યાલય, વડોદરા ને તેની નીચે જણાવેલ શાખા માટે ભાડેથી જગ્યા જોઈએ છે.

ક્રમ	પ્રસ્તાવિત શાખા /કાર્યાલય	જરૂરી કાર્પેટ એરિયા ચો.ફુટમાં	શાખા /કાર્યાલય નું સ્થળ	નોંધ
૧.	બાકરોલ શીયાળા શાખા	૮૦૦ ચો.ફુટ થી ૧૦૦૦ ચો.ફુટ (ભોંયતળીના પર)	હાલ ની સાથેના થી ૧ કિ.મી. રેલવે થી	ભોંયતળીએ

પરિસર ને પર્ચાઇન પાર્કિંગની જગ્યા સાથે પડેશન માટે તૈયાર હોવી જોઈએ. કુપા કરી કોઈ દલાલ કે વરોડિયાએ સંપર્ક કરવો નહીં. સરકારી/અર્ધ સરકારી સંસ્થા અથવા જાહેર ક્ષેત્રની સંસ્થા ને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓફર બે અલગ ક્વોર્ટેમાં (ટેકનિકલ અને કાયદાત્મકીય લીડર્સ) તેમજ બન્ને અલગ કવચમાં ઉપર મુજબ દર્શાવેલી તે બન્ને કવર એક કવચમાં જમા કરવાના રહેશે. ક્વોર્ટે/બિઝનેસ અને શરતો વેબસાઇટ <http://www.centralbankofindia.co.in> પરથી ડાઉનલોડ કરી શકો. અરજી જમા કરાવવાની અંતિમ તારીખ ૧૬.૧૧.૨૦૨૫ થી ૨૨.૧૧.૨૦૨૫, સમય: ૪.૦૦ સુધીના બાકરોલ સિઆના કેમ્પસમાં, આજવા-બિનેટા રોડ, બાકરોલ-૩૬૦૦૧૬, તા. વાહોડિયા જિલ્લો વડોદરા ખાતે અથવા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સેનિય કાર્યાલય, પહેલો માળ, સીટી ટેલીફોન એક્સચેન્જ, બીએસએનએલ ભવન, કુબેર ભવનની પાસે, જેલ રોડ, વડોદરા - ૩૬૦૦૦૧ છે.

નોંદ: ૧) ઉપર જણાવેલ શાખા માટે ઓફર સ્વીકાર થયેથી સ્ટોળ રૂમ નુ બાંધકામ (રીઝર્વ બેંકના નિયમ અનુસાર) અને જરૂરી સીવીલ કામ જગ્યાના માલિક દ્વારા તેઓના ખર્ચે તૈયાર કરી આપવાનો રહેશે. એટીએમ ની જગ્યા પણ બેંક પ્રમાણે બાંધી આપવાની રહેશે.

૨) કોઈપણ કે તમામ ઓફર સ્વીકારવાની કે રદ કરવાના તમામ અધિકાર બેંક આપવાલિ રાખે છે.

તા.૧૬.૧૧.૨૦૨૫ સહી/-

સ્થળ: વડોદરા

સહી/-

અધિકૃત અધિકારી - સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

જાહેર હરાજી	
જિ. શિ. સ. વડોદરા જિલ્લાની હોમોઈ તાલુકાની મોટા હબીપુરા પ્રાથમિક શાળાના જરૂરી કુલ સાત(૦૭) ઉંબા જુના ઓરડાઓની જાહેર હરાજી તારીખ: ૧૭-૧૧-૨૦૨૫ ને સંમતવાર ના રોજ સમય ૧૨:૦૦ કલાકે સ્થળ મોટા હબીપુરા પ્રાથમિક શાળામાં રાખેલ છે. જે ઈસમો હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમને પોતાના ઓળખ અને રહેઠાણનાં પુરાવા (ચુટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ વગેરે) રજુ કરી ડીપોઝિટની રકમ ૬૫૦૦/- જમા કરાવી હરાજીમાં ભાગ લેવાનો રહેશે. જરૂરી જુદા પુરાવાળા કુલ ૦૫ (પાંચ) અને ૦૨ (બે) ધાબા વાળા એમ કુલ ૦૭ (સાત) ઉંબા પતરાવાળા ઓરડાઓની અપસ્ટેટ કિંમત રૂપિયા ૬૨૦૦૦/- (બાસઢ હજાર રૂપિયા પુરા) છે. હરાજી માટેના ઓરડાઓની સામગ્રી શાળા સમય દરમિયાન જોઈ શકાશે. હરાજી શાંક્ય રાખવી કે નહીં તેની તમામ સત્તા એસ.એમ.સી મોટા હબીપુરા પ્રાથમિક શાળાની રહેશે.	
નોંધ:હરાજીની શરતો હરાજીના દિવસે સ્થળ પર વાંચી સંમતાવવામાં આવશે.	
અક્ષય શ્રી, SMC મોટા હબીપુરા પ્રાથમિક શાળા, ૯૯૭૬૬૨૩૬૯	

વડોદરા મહાનગરપાલિકા

www.vmmc.gov.in

ટ્રેડર નોટીસ

વડોદરા મહાનગરપાલિકામાં ચોચ વિભાગ તેમજ ચોચ શેડમાં નોંધાયેલ માલ્ય ઉત્પન્નકારો પાસેથી તથા સરકારી/અર્ધસરકારી સંસ્થાના નોંધાયેલા અનુબાધી ઉત્પન્નકારો પાસેથી નીચે જણાવેલ કામ માટે મોહરબંધ ભાવપત્રો મેળવવામાં આવે છે.

અ.નં.	પી.આર.ઓ. નંબર	વિભાગનું નામ	કામની સંખ્યા	અંદાજિત રકમ
૧	૮૩૭/૨૫-૨૬	સેન્ટ્રલ વર્કશોપ	૧૫	૫,૮૭,૯૬૭/-
૨	૮૩૮/૨૫-૨૬	રોડ પ્રોજેક્ટ	૦૨	૭,૦૦,૦૦,૦૦૦/-

નોંધ: અ.નં. ૨ ની મહેસત અ-ટ્રેડરનગીની છે.

ઉપરોક્ત કામના ટ્રેડર શ્રેણી માટે વિસ્તૃત માહિતી તે સંબંધિત વિભાગમાંથી ઉપરોક્ત સૂચિત વેબસાઇટ પરથી મળી રહેશે. ડોઉબલ ભાવપત્ર મંજૂર/નામંજૂર કરવાની અનામતિ સાથે પ્રકાશિત કરાશે.

પી.આર.ઓ.નં.૮૩૮/૨૦૨૫-૨૬

જનસંપર્ક વિભાગ દ્વારા પ્રકાશિત

Brijlaxmi Leasing and Finance Limited

Regd. Office: 24, Sovernarnput Society, Chikwadda, Near Jetpur Road, Alkapuri, Vadodra 390 007

Website: www.brijlaxmi.com, Email: boardgroup99@gmail.com.

CIN: L6593GJ1990PLC014183

Extract of Unaudited Financial Results for the Second Quarter and Half Year ended on 30th September, 2025

(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter ended	Half Year ended	Year ended
		30.09.2025 (Unaudited)	30.09.2024 (Unaudited)	31.03.2025 (Audited)
1.	Total Income from Operations	64.93	55.21	121.27
2.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional Items & Extraordinary Items)	46.46	(72.45)	59.76
3.	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or Extraordinary Items)	46.46	(72.45)	59.76
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	38.06	(72.45)	46.09
5.	Total comprehensive income for the period (comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax))	24.67	(72.45)	24.09
6.	Paid up Equity Share Capital	646.35	646.35	646.35
7.	Earning per share	0.59	(1.12)	0.71

Note:

- The above standalone financial results for the quarter ended 30.09.2025 have been reviewed by the Audit Committee after their approval and taken on record by the Board of Directors of the Company at their meeting held on 14th November, 2025.
- The Financial Results for the quarter ended 30th September, 2025 has been review by the Statutory Auditors of the Company.
- The Company has engaged in Investment and financing activities and accordingly there is no separate reportable segment as per IND AS 108 specified under section 133 of the Companies Act, 2013.
- Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures. Comparable, wherever necessary.

By the Order of the Board
SD/-

Siddharth Chaturvedi
Managing Director and CFO

Date : 14.11.2025

Place : Vadodra